




Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt. of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

-  Residential Zone I-R1
 Village Boundary
 TPS Boundary
 Existing Road
 Proposed Road
 National Highway
 Waterbody



NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2019.1224/6521
Amount Recieved Rs. 2000/- P 11000
Receipt No. 733 / 12 Dtd 24/12/2019.

TRUE COPY

14/12/2019

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDBAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

Prep. By:

Chd. By:

H. D' man:

PART PLAN SHOWING
R.S. NO.:- 1528
VILLAGE :- VATVA
TALUKA:-VATVA
DISTRICT:- AHMEDABAD




1 c.m. = 40 mt.

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt.of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

LEGEND

- Residential Zone I-R1
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road
- Waterbody
- National Highway



This part plan is certified for the R.S. NO. :- 1528

- NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
- (2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2019..1224.../...652)
Amount Recieved Rs. 2,000...../- P/1000
Receipt No.....733...../.....12.....Dtd.24/12/2019.

TRUE COPY


[Signature]
24/12/2019

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

Prep. By:

Chd. By:

H. D' man:



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક:- RZ20191224/ 6522

અરજી તા.: ૨૪/૧૨/૨૦૧૯

પરિણે નં.: ૭૩૩/૧૧, તા.: ૨૪/૧૨/૨૦૧૯.

અરજદારશ્રી સુનિલ પટેલ,

વટવા, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GHV/207 OF 2014/ DVP-112013-4777-L, તા.: ૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

મોજે/ રેવન્યુગામ :- વટવા

રે. સર્વે. નંબર:- :- ૩૫૩

રી.ડી.પી. શીટ નં. :- ૧૨૯

ની જમીનમાંથી પશ્ચિમ તરફે ઉત્તર થી દક્ષિણ દિશા તરફ ૧૮.૦૦મી. નો રસ્તો પસાર થાય છે, તેની અસર થાય છે. તેમજ, બાકી રહેતો ભાગ “રહેણાક ઝોન- ૧(એક) R1” માં આવે છે.

નોંધ:

૧. સદરહુ જમીન પ્રિલિમિનરી મંજૂર ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.: ૭૯- (વટવા-૭)ના વિસ્તારમાં આવે છે.

૨. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

તારીખ: ૨૪/૧૨/૨૦૧૯.

જ. ડ્રાફ્ટસમેન

24/12/2019
+ હેડ ડ્રાફ્ટસમેન

ખરી નકલ

24/12/2019

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક:- RZ20191224/ 6522

અરજી તા.: ૨૪/૧૨/૨૦૧૯

પરિણામ નં.: ૭૩૩/૧૧, તા.: ૨૪/૧૨/૨૦૧૯.

અરજદારશ્રી સુનિલ પટેલ.,

વટવા, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GH/V/207 OF 2014/ DVP-112013-4777-L, તા.: ૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

મોજે/ રેવન્યુગામ :- વટવા

રે. સર્વે. નંબર:- :- ૧૫૨૮

રી.ડી.પી. શીટ નં. :- ૧૨૯

ની જમીનની પૂર્વ તરફે ઉત્તર થી દક્ષિણ દિશા તરફ કેનાલને સમાંતર પસાર થતા ૧૨.૦૦મી રોડની અસર થાય છે. સદરહું રસ્તામાથી પશ્ચિમ બાજુ દક્ષિણ દિશા તરફ પસાર થતા ૧૮.૦૦મી રોડની તેમજ રોડ ગોળાઈની અસર થાય થાય છે, બાકી રહેતો ભાગ “રહેણાક ઝોન- ૧ (એક) R1” માં આવે છે.

નોંધ:

૧. સદરહું જમીન પ્રિલિમિનરી મંજૂર ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.: ૭૯- (વટવા-૭)ના વિસ્તારમાં આવે છે.

૨. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

તારીખ ૨૪/૧૨/૨૦૧૯.

જુ. ડ્રાફ્ટસમેન

24/12/2019
+ હેડ ડ્રાફ્ટસમેન

ખરી નકલ

24/12/2019

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ.